

SARDAR PATEL UNIVERSITY
BCom (I Semester) Examination
2016

Tuesday, 12th April

2.30 pm - 4.30 pm

UB01ECOM02/14 - Advanced Accounting II

કુલ ગુણ: ૬૦

નોંધ: જમણી બાજુના આંક પ્રશ્નના ગુણ દર્શાવે છે.

- પ્ર.૧ મુખ્ય ઓફિસ શાખાને મૂળકિંમત પર ૧૦% નફો ચઢાવીને ભરતિયા કિંમતે માલ મોકલે છે. મુખ્ય ઓફિસના ચોપડે તા. ૩૧-૩-૨૦૧૫ના રોજ પૂરા થતા વર્ષનું શાખા ખાતું નીચે મુજબ છે. તમારે શાખા વેપાર ખાતું અને નફા-નુકશાન ખાતું મુખ્ય ઓફિસના ચોપડામાં તૈયાર કરવાનું છે. (૧૫)

શાખા ખાતું

વિગત	રૂ.	વિગત	રૂ.
બાકી આગળ લાવ્યા:		શરૂઆતના સ્ટોક તફાવત ખાતે	૧૦૦૦૦
સ્ટોક ૧૧૦૦૦૦		શાખાએ પરત કરેલ માલ ખાતે	૧૧૦૦૦
પેટા રોકડ ૧૪૦૦		રોકડ ખાતે:	
દેવાદારો ૧૪૦૦૦૦		રોકડ વેચાણ: ૭૦૫૦૦૦	
ફર્નિચર ૫૦૦૦૦	૩૦૧૪૦૦	દેવાદારો પાસેથી વસુલાત ૩૮૩૦૦૦	
શાખાને મોકલેલ માલ	૬૬૦૦૦૦	ઘાલખાધ પરત ૪૦૦૦	૧૦૬૨૦૦૦
બેંક ખાતે (ખર્ચા):		માર્ગસ્થ માલ	૩૩૦૦૦
ભાડું ૧૭૦૦૦		શાખાને મોકલેલ માલ તફાવત ખાતે	૬૦૦૦૦
પગાર ૪૨૦૦૦		બાકી આગળ લઈ ગયા:	
કરવેરા ૧૦૦૦૦		સ્ટોક ૨૨૦૦૦૦	
જાહેરાત ખર્ચ ૧૭૦૦૦		પેટા રોકડ ૧૫૦૦	
મજૂરી ૮૦૦૦	૬૪૦૦૦	દેવાદારો ૧૩૮૦૦૦	
માર્ગસ્થ માલ તફાવત ખાતે	૩૦૦૦	ફર્નિચર ૪૭૫૦૦	૪૦૭૦૦૦
શાખાએ માલ પરત તફાવત ખાતે	૧૦૦૦		
બેંક ખાતે (પેટા રોકડ)	૧૧૦૦		
આખર સ્ટોક તફાવત ખાતે	૨૦૦૦૦		
ચોખ્ખો નફો: સામાન્ય ન.નુ. ખાતે	૨૩૨૫૦૦		
	૧૬૪૩૦૦૦		૧૬૪૩૦૦૦

વધારાની માહિતી:

- (૧) વર્ષ દરમિયાન શાખાના દેવાદારોએ રૂ. ૫૫૦૦૦નો માલ પરત કર્યો હતો.
- (૨) શાખાના દેવાદારો ખાતે ઘાલખાધ રૂ. ૧૦૦૦ માંડી વાળ્યા અને દેવાદારોને રૂ. ૨૦૦૦ વટાવ આપ્યો.
- (૩) વર્ષ દરમિયાન શાખાના દેવાદારો ખાતે રૂ. ૨૫૦૦ વ્યાજ ગણવામાં આવ્યું હતું.

અથવા

પ્ર.૧ અમદાવાદની મુખ્ય ઓફિસ તેની નકિયાદ શાખાને ભરતિયા કિંમતે માલ મોકલે છે. ભરતિયા કિંમત પર ૨૫% નફો ચઢાવીને ભરતિયા કિંમત નક્કી કરેલ છે.

(૧૫)

મુખ્ય ઓફિસ શાખાને પરચૂરણ ખર્ચા સિવાયના ખર્ચા માટે રોકડ મોકલે છે અને દરરોજ શાખા પાસેથી રોકડ મેળવે છે.

તા. ૩૧-૩-૨૦૧૫ના રોજ પૂરા થતા વર્ષની નકિયાદ શાખાની માહિતી નીચે મુજબ છે.

(૧)

વિગત	૧-૪-૨૦૧૪ (રૂ.)	૩૧-૩-૨૦૧૫ (રૂ.)
સ્ટોક (ભરતિયા કિંમત)	૩૨૦૦૦	૨૪૦૦૦
પેટા રોકડ	૧૦૦૦	(?)
દેવાદારો	૨૦૦૦૦	૨૮૦૦૦
ફર્નિચર	(?)	૧૭૦૦૦
અગાઉથી ચૂકવેલ ભાડું	૬૦૦	(?)
ચૂકવવાના બાકી ખર્ચા	૭૦૦	-

(૨) વર્ષ દરમિયાનના વ્યવહારો:

	રૂ.
શાખાને મોકલેલ માલ (ભરતિયા કિંમત)	૨૪૦૦૦૦
શાખાને મોકલેલ પેટા રોકડ	૭૦૦
શાખાએ પરત કરેલ માલ (ભરતિયા કિંમત)	૧૨૦૦૦
ગ્રાહકોએ પરત કરેલ માલ	૬૦૦૦
દેવાદારો પાસેથી મળેલ રોકડ (ઘાલખાધ પરતના રૂ. ૨૦૦૦ સહિત)	૧૦૦૦૦૦
માંડી વાળેલ ઘાલખાધ	૮૦૦૦
ગ્રાહકોને આપેલ વટાવ	૬૦૦
ગ્રાહકોને અમાન્ય કરેલ વટાવ	૨૦૦
કુલ વેચાણ	૩૧૬૦૦૦

(૩)

મુખ્ય ઓફિસ દ્વારા ચૂકવેલ ખર્ચા:	રૂ.
વાર્ષિક ભાડું (તા. ૧-૭-૨૦૧૪ના રોજ ચૂકવેલ)	૫૪૦૦
પગાર (તા. ૨૮-૨-૨૦૧૫ સુધીનો ચૂકવેલ)	૬૬૦૦
વીમો (તા. ૩૦-૬-૨૦૧૫ના રોજ પૂરા થતા વર્ષનો)	૧૦૮૦
મજૂરી	૩૦૦
અન્ય ખર્ચા	૭૦૦

(૪)

શાખાએ ચૂકવેલ ખર્ચા:	રૂ.
પરચૂરણ ખર્ચ	૫૪૦

(૫)

ફર્નિચર પર વાર્ષિક ૧૫% લેખે સીધી લીટીની પદ્ધતિથી ઘસારો ગણો. ઉપરની માહિતી પરથી મુખ્ય ઓફિસના ચોપડામાં જરૂરી ખાતાં તૈયાર કરો.

પ્ર.૨ તા. ૩૧-૩-૨૦૧૫ના રોજ પૂરા થતા વર્ષની ખેડૂત શ્રી મહેશભાઈ પટેલના નીચે આપેલ કાચા સરવૈયા પરથી તેમના વાર્ષિક હિસાબો તૈયાર કરો.

(૧૫)

ઉધાર બાકીઓ	રૂ.	જમા બાકીઓ	રૂ.
શરૂઆતની બાકીઓ:		વેચાણ:	
બિયારણ	૨૮૦૦૦	અનાજ	૧૨૪૦૦૦
ખાતર	૩૫૦૦૦	દૂધની બનાવટો	૨૮૦૦૦
અનાજ	૩૫૦૦૦	ઢોર-ઢાંખર	૧૬૦૦૦
ઢોર-ઢાંખર	૭૦૦૦૦	લેણદારો	૭૮૦૦૦
ખરીદી:		૬%ની લોન	૮૦૦૦૦
બિયારણ	૧૫૦૦૦	મૂડી	૧૪૦૦૦૦
ખાતર	૧૩૦૦૦	સરકારી સહાય	૪૪૦૦૦
ઢોર-ઢાંખર	૨૦૦૦૦		
દેવાદારો	૫૦૦૦૦		
મજૂરી: હંગામી મજૂરોને	૨૪૦૦૦		
કાયમી મજૂરોને	૧૮૦૦૦		
ઉપાડ	૧૬૦૦૦		
રોકડ	૧૪૦૦૦		
ખેતીના સાધનો	૩૦૦૦૦		
જમીન-મકાન	૮૦૦૦૦		
વાડ કરવાનો ખર્ચ	૨૨૦૦૦		
કો.ઓ. સોસાયટી પાસેથી અનાજ			
વેચાણના લેણાં	૩૦૦૦૦		
જમીન-મહેસુલ	૧૦૦૦૦		
	૫૧૦૦૦૦		૫૧૦૦૦૦

વધારાની માહિતી:

- (૧) તા. ૩૧-૩-૨૦૧૫ના રોજ આખર સ્ટોક: ઢોર-ઢાંખર રૂ. ૬૦૦૦૦, બિયારણ રૂ. ૫૦૦૦, ખાતર રૂ. ૧૨૦૦૦, અનાજ રૂ. ૧૩૦૦૦.
- (૨) ખેતીના સાધનો અને જમીન-મકાન પર ૧૦% ઘસારો ગણો.
- (૩) વાડ કરવાનો ખર્ચ બે વર્ષમાં માંડી વાળવાનો છે.
- (૪) રૂ. ૧૦૦૦૦ ઘાસનું વેચાણ કર્યું હતું. જેમાંથી ૫૦% ઉધાર વેચાણ છે. ઉધાર વેચાણના ૫૦% ઘાસખાદ્ય તરીકે માંડી વાળવાના છે.

અથવા

પ્ર.૨ શ્રી રમેશભાઈ પટેલની નીચે આપેલ માહિતી પરથી તા. ૩૧-૩-૨૦૧૫ના રોજ પૂરા થતા વર્ષનું કૃષિ ખાતું તૈયાર કરો.

(૧૫)

શરૂઆતનો સ્ટોક (૧-૪-૨૦૧૪):

	રૂ.	રૂ.
ખાતર	૫૦૦૦	
બિયારણ	૩૦૦૦	
ઊભો પાક	૧૦૦૦૦	
ઢોર-ઢાંખર	૫૦૦૦૦	૬૮૦૦૦

ખરીદી:

ખાતર	૧૦૦૦૦	
બિયારણ	૧૫૦૦૦	
જંતુનાશક દવાઓ	૨૦૦૦	
ઢોર-ઢાંખર	૨૦૦૦૦	૪૭૦૦૦

મજૂરી			૫૦૦૦
ટ્રેક્ટર			૧૮૦૦૦૦
૧૦% ની કો.ઓ. સોસાયટીમાંથી લોન			૧૦૦૦૦૦
જમીન-મહેસુલ			૨૦૦૦
ખેતીના સાધનો			૬૦૦૦૦
સરકારી સહાય			૬૦૦૦
લોન પર વ્યાજ			૪૦૦૦
વાડ કરવાનો ખર્ચ			૨૦૦૦૦
ઢોર-ઢાંખરની સારવારનો ખર્ચ			૩૦૦૦
વીમા પ્રિમીયમ:	ઢોર-ઢાંખર	૧૦૦૦	
	પાક	૫૦૦	૧૫૦૦
ખેડાણ અંગેનો ખર્ચ			૨૦૦૦
સિંચાઈ અંગેનો ખર્ચ			૩૫૦૦
વિજળી ખર્ચ			૬૫૦૦
ટ્રેક્ટરનું મરામત અને કિઝલ			૧૬૦૦૦
વેચાણ:	ઘાસ	૫૦૦૦	
	દૂધ	૨૦૦૦૦	
	ચોખા	૬૦૦૦૦	
	ઘઉં	૪૦૦૦૦	૧૨૫૦૦૦

અન્ય માહિતી:

- (૧) આખર સ્ટોક: ખાતર રૂ. ૩૦૦૦, બિયારણ રૂ. ૧૫૦૦, ઊભો પાક રૂ. ૧૫૦૦૦, ઢોર-ઢાંખર, રૂ. ૬૦૦૦૦
- (૨) ઢોરને ખવડાવવા માટે ઉગાડેલ ઘાસ (૨જકો) ની કિંમત રૂ. ૨૦૦૦ છે.
- (૩) વપરાશ માટે લીધેલ ઘઉં રૂ. ૫૦૦૦ અને ચોખા રૂ. ૩૦૦૦ના છે.
- (૪) ધર્માદા પેટે આપેલ અનાજની કિંમત રૂ. ૧૦૦૦૦ છે.
- (૫) વાડ કરવાનો ખર્ચ પાંચ વર્ષમાં માંડી વાળવાનો છે.
- (૬) ચૂકવવાની બાકી મજૂરી રૂ. ૩૦૦૦ અને જમીન મહેસુલ રૂ. ૧૦૦૦ છે.
- (૭) ટ્રેક્ટર પર વાર્ષિક ૧૦% લેખે અને ખેતીના સાધનો પર વાર્ષિક ૫% લેખે ઘસારો ગણો.

પ્ર.૩ તા. ૩૧-૩-૨૦૧૫ના રોજ પૂરા થતા વર્ષના એક સોલીસીટરના નીચે આપેલ કાચા સરવૈયાની વિગતો (૧૫)
પરથી, તા. ૩૧-૩-૨૦૧૫ના રોજ પૂરા થતા વર્ષનું ઊપજ-ખર્ચ ખાતું અને તે જ રોજનું પાકુ સરવૈયું તૈયાર કરો.

વિગત	ઉધાર બાકી (રૂ.)	જમા બાકી (રૂ.)
મૂડી	-	૨૨૦૦૦૦
ફર્નિચર	૧૦૦૦૦૦	-
લાયબ્રેરી	૬૦૦૦૦	-
કોમ્પ્યુટર	૮૦૦૦૦	-
નહિ કમાયેલ નફા અંગેનું અનામત (તા. ૧-૪-૨૦૧૪ના રોજ)	-	૬૪૦૦૦
પગાર	૪૦૦૦૦૦	-
ભાડું	૧૨૦૦૦૦	-
ઓફિસ ખર્ચ	૧૧૦૦૦૦	-
ખર્ચના બીલો અંગેની બાકી રકમ	૯૬૦૦૦	-
ચાલુ કામ ખાતે (તા. ૧-૪-૨૦૧૪ના રોજ)	૪૪૦૦૦	-
કમાયેલ ફી	-	૧૨૫૬૦૦૦
ઉપાડ	૩૪૦૦૦૦	-

અસીલો પાસે બાકી લેણાં	૫૦૦૦૦	-
બેંક સિલક (અસીલો)	૯૪૦૦૦	-
બેંક સિલક (ઓફિસ)	૧૦૬૦૦૦	-
અસીલોનું ડિપોઝીટ ખાતું	-	૬૦૦૦૦
	૧૬૦૦૦૦૦	૧૬૦૦૦૦૦

વધારાની માહિતી:

- (૧) તા. ૩૧-૩-૨૦૧૫ના રોજ ચાલુકામ ખાતાની બાકી રૂ. ૭૦૦૦૦ છે.
- (૨) અસીલો પાસે બાકી લેણાંની રકમ રૂ. ૬૦૦૦, ચોપડામાં ભૂલથી ઓફિસ ખર્ચ ખાતે ઉધારેલ છે.
- (૩) અસીલો પાસે બાકી લેણાં પૈકી મળેલ રકમ રૂ. ૪૦૦૦ ભૂલથી અસીલોના ડિપોઝીટ ખાતે જમા થયેલ છે.
- (૪) ફર્નિચર અને લાયબ્રેરી પર વાર્ષિક ૧૦% લેખે ઘસારો ગણવાનો છે.

અથવા

- પ્ર.૩ શ્રી સુનીલ જોશી ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ છે. તેમનું તા. ૩૧-૩-૨૦૧૫ના રોજ પૂરા થતા વર્ષનું આવક-જાવક ખાતું નીચે પ્રમાણે છે. (૧૫)

આવક-જાવક ખાતું

આવક	રૂ.	જાવક	રૂ.
બાકી આગળ લાવ્યા	૨૦૦૦૦	ભાડું	૩૦૦૦૦
મળેલ ફીની આવક	૪૦૦૦૦૦	પગાર	૬૦૦૦૦
મળેલ પગાર	૧૨૦૦૦૦	છપામણી અને સ્ટેશનરી	૧૦૦૦૦
(કોલેજમાં વ્યાખ્યાતા તરીકે)		વિજળી ખર્ચ	૨૦૦૦૦
		મોટર કાર ખર્ચ	૩૦૦૦૦
		ઉપાડ	૨૫૦૦૦૦
		ટેલિફોન ખર્ચ	૧૫૦૦૦
		પુસ્તકો અને સામગ્રી	૫૦૦૦
		વર્તમાનપત્રનું બિલ	૩૦૦૦
		પરચૂરણ ખર્ચ	૪૦૦૦૦
		બાકી આગળ લઈ ગયા	૭૭૦૦૦
	૫૪૦૦૦૦		૫૪૦૦૦૦

નીચેની વધારાની માહિતીને ધ્યાનમાં લઈ તા. ૩૧-૩-૨૦૧૫ના રોજ પૂરા થતા વર્ષનું ઉપજ-ખર્ચ ખાતું તથા તે જ રોજનું પાકું સરવૈયું તૈયાર કરો.

- (૧) તા. ૧-૪-૨૦૧૪ના રોજ તેની અન્ય મિલકતો નીચે મુજબ હતી:

રૂ.

મોટર કાર	૧૦૦૦૦૦
ફર્નિચર	૬૦૦૦૦
અન્ય મિલકતો	૨૦૦૦૦

- (૨) મોટરકાર ખર્ચ પૈકી ૫૦% રકમ ઘર વપરાશ અંગેની છે.
- (૩) ટેલિફોન ખર્ચની ૪૦% રકમ ઘર વપરાશની છે.
- (૪) પરચૂરણ ખર્ચમાં રૂ. ૧૦૦૦૦ની રકમ ઘર વપરાશની સામગ્રીની ખરીદી અંગેની છે.
- (૫) મોટરકાર પર વાર્ષિક ૧૦% લેખે અને ફર્નિચર પર વાર્ષિક ૫% લેખે ઘસારો ગણવાનો છે.

પ્ર.૪ શ્રી અનિલ પટેલ તા. ૩૦મી જૂન ૨૦૧૫ના રોજ નાદાર જાહેર થાય છે ત્યારે તેમની નાણાંકીય સ્થિતિ નીચે મુજબ હતી.

(૧૫)

	રૂ.	
પરચૂરણ દેવાદારો: સફર	૧૦૦૦૦૦	
શકમંદ	૩૦૫૦૦૦	(ઉપજવા ધારેલ રૂ. ૨૦૦૦૦૦)
ફૂલત	૧૦૦૦૦૦	
રિલાયન્સ લિ. ના શેર	૨૫૦૦૦૦	(ઉપજવા ધારેલ રૂ. ૧૫૦૦૦૦)
ટાટા લિ.ના શેર	૮૫૦૦૦૦	(ઉપજવા ધારેલ રૂ. ૭૫૦૦૦૦)
સફ્ટવેર ગ્રુપ્સ	૧૫૦૦૦૦	
ચાલુ ખાતાના લેણદારો	૬૦૦૦૦૦	
ટાટા લિ.ના શેર પર પ્રથમ હક્ક ધરાવતા લેણદારો	૪૦૦૦૦૦	
ટાટા લિ.ના શેર પર બીજો હક્ક ધરાવતા લેણદારો	૩૫૦૦૦૦	(રૂ. ૩૦૦૦૦૦ સુધીનો બોજો)
દેવી હૂંડીઓ	૫૦૦૦૦	
વટાવેલી નકારાચ તેવી લેણી હૂંડીઓ	૪૧૨૦૦	
ભાડું, કરવેરા અને મજૂરીના લેણદારો	૩૦૦૦૦	(રૂ. ૨૫૦૦૦ પસંદગીના છે.)
ફર્નિચર અને ફિક્ચર્સ	૪૦૦૦૦	(ઉપજવા ધારેલ રૂ. ૩૦૦૦૦)
બેંકમાં રોકડ	૧૦૦૦	
સ્ટોક	૩૮૮૮૦૦	(ઉપજવા ધારેલ રૂ. ૩૦૦૦૦૦)
લેણી હૂંડી	૧૦૦૦૦૦	(ઉપજવા ધારેલ રૂ. ૭૦૦૦૦)
ઓફિસમાં રોકડ	૨૦૦૦	
નાદારીનો ખર્ચ	૧૮૦૦	

વધારાની માહિતી:

તેમણે ૧લી જુલાઈ ૨૦૧૨ના રોજ રૂ. ૫૦૦૦૦૦ની મૂડીથી ધંધો શરૂ કર્યો હતો. ધંધામાં દર વર્ષે મૂડી પર વ્યાજ રૂ. ૩૦૦૦૦ ગણ્યા બાદ પહેલા બે વર્ષમાં અનુક્રમે રૂ. ૧૦૦૦૦૦ અને રૂ. ૭૫૦૦૦૦નો નફો થયો હતો અને ત્રીજા વર્ષે રૂ. ૫૦૦૦૦ની ખોટ ગઈ હતી.

આ સમગ્ર સમય દરમિયાન તેમનો ઉપાડ રૂ. ૨૫૦૦૦૦નો હતો. ઉપરની વિગતોને આધારે સ્થિતિદર્શક પત્રક અને તૂટખાતું બનાવો.

અથવા

પ્ર.૪

- (અ) સ્થિતિદર્શક પત્રક અને પાકું સરવૈયું વચ્ચેનો તફાવત લખો.
 (બ) ટૂંકનોંધ લખો : પસંદગીના લેણદારો
 (ભ) 'તૂટ ખાતું' નો નમૂનો દર્શાવો.

(૦૬)

(૦૪)

(૦૫)

